



રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા FIEO ના સંયુક્ત ઉપક્રમે “Enhancing Export Business in the New Financial Year and Latest Updates” અંગે સેમિનાર યોજવામાં આવેલ...

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન (FIEO) ના સંયુક્ત ઉપક્રમે “Enhancing Export Business in the New Financial Year and Latest Updates” અંગે તા.૮-૪-૨૦૨૨, શુક્રવારના રોજ સેમિનાર યોજવામાં આવેલ.

સેમિનારના પ્રારંભે રાજકોટ ચેમ્બરના ઉપપ્રમુખશ્રી પાર્થભાઈ ગણાત્રાએ સાને આવકારી ઉદ્યોગકારોના પ્રશ્નોને વાચા આપવા રાજકોટ ચેમ્બર હંમેશા સજાગ છે. આયાત-નિકાસ અંગે ઉદ્યોગકારોને પુરતી માહિતી મળી રહે તે ઉદ્દેશથી અવાર-નવાર વિવિધ સેમિનારોનું આયોજન કરવામાં આવે છે. ત્યારે નવા ચાલુ થયેલ નાણાક્રિય વર્ષમાં નિકાસને વેગ મળે તે ઉદ્દેશથી આજના આ સેમિનારનું આયોજન કરેલ છે. જે ખુબ જ ઉપયોગી બની રહેશે. ત્યારબાદ રાજકોટ ચેમ્બરના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવ દ્વારા રાજકોટમાં ઉદ્યોગોનો વિકાસ દિન-પ્રતિદિન વધતો રહે છે અને રાજકોટ ઈન્ડસ્ટ્રીયલ હબ બની ગયેલ છે. ભારત દેશે નિકાસક્ષેત્રે ૪૦૦ બીલીયન ઈકોનોમીની સિદ્ધિ હાંસલ કરી છે. તેમાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. જે આપણા માટે ગૌરવની બાબત છે. તેમજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૫ ટ્રીલીયન ઈકોનોમી વિઝનને સાર્થક કરવામાં આપણે સૌએ સહભાગી બનીશું. સાથો સાથ વેપાર-ઉદ્યોગકારોને કોઈપણ જાતની મુશ્કેલી અથવા પ્રશ્નો હોય તો રાજકોટ ચેમ્બરને મોકલી આપી તેનું સચોટપણે નિરાકરણ લાવીશું તેમ જણાવેલ.

સેમિનારના અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રાજકોટ જોઈન્ટ DGFT શ્રી અભિષેક શર્માએ સેમિનારમાં હાજર રહેવા આમંત્રણ આપવા બદલ આભાર વ્યક્ત કરેલ. તેમજ MEIS ના મળવાપાત્ર લાભ માટેની અરજીઓ સ્વીકારવાની છેલ્લી તા.૧૩-૪-૨૦૨૨ છે તો આ અંગે કોઈપણ મુંઝવણ હોય તો જાણ કરવી. સરકારશ્રી દ્વારા AEO, EPCG, RoDTEP, વગેરે મહત્વની સ્કીમો વિશે વિસ્તૃત જાણકારી આપેલ તથા ડોમેસ્ટીક માર્કેટમાં ગુજરાતનું યોગદાન સાફ રહ્યું છે જે સારી બાબત ગણાય. નિકાસકારોને કોઈપણ મુશ્કેલી ઉદ્ભવે તો વિના સંકોચે રાજકોટ DGFT ઓફિસનો સંપર્ક કરવા જણાવેલ.

સેમિનારના વક્તાશ્રી મિહીરભાઈ શાહએ આજના સેમિનારનું આયોજન કરવા તથા આમંત્રણ આપવા બદલ આભાર વ્યક્ત કરેલ. નિકાસક્ષેત્રે ભારત દેશે ૪૦૦ બલીયન ઈકોનોમીની સિદ્ધિ હાંસલ કરેલ તેની સહર્ષ નોંધ લીધેલ. તેમજ નિકાસ અંગેના વિવિધ પાસાઓની ચર્ચા કરી નવા નાણાકીય વર્ષમાં નિકાસને વધુ વેગ કેવી રીતે આપી શકાય તેના વિવિધ મુદ્દાઓની ચર્ચા કરી જેમાં ખાસ કરીને નિકાસકારોએ પોતાનું IEC દર ફાઈનાન્સીયલ વર્ષે અપડેટ કરવું, RCMC રીન્યું કરવું, GST LUT રીન્યું કરવું, DGFT ના કોમન પોર્ટલમાં શરૂ થયેલ સર્ટીફિકેટ ઓફ ઓરીજીન અંગે, ICEGATE ના રજીસ્ટ્રેશન સાથે ADCODE / બેન્ક એકાઉન્ટ-ઈન્સ્ટેન્ટીવ લેજર અંગે, FTP ની મુદત ૩૦-૯-૨૨ સુધી વધેલ તે અંગે, એક્ષપોર્ટ ઈન્સેન્ટીવ, ઈન્ટરેસ્ટ ઈકવીલાઈઝેશન સ્કીમ અંગે, ઓથોરાઈઝડ ઈકોનોમીક ઓપરેટર સ્કીમ અંગે, ન્યુ માર્કેટ-પ્રોડક્ટ તથા ફોરેન ટ્રેડ એગ્રીમેન્ટ અંગે, એડવાન્ટેજ ઓફ એક્ષપોર્ટર્સ, વિગેરે વિવિધ મુદ્દાઓની વિસ્તૃત છણાવટ કરી પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જાણકારી-માર્ગદર્શન આપેલ. બાદમાં ઉપસ્થિત નિકાસકારો દ્વારા પુછાયેલ પ્રશ્નોના વિગતવાર જવાબો આપી સમજાવવાના પ્રયત્નો કરેલ.

સમગ્ર સેમિનારનું સંચાલન તથા ઉપસ્થિત મહાનુભાવો તથા સભ્યોશ્રીઓનો આભાર વ્યક્ત FIEO ના ગુજરાત વેસ્ટર્ન રીજીઓનલ હેડશ્રી જયપ્રકાશ ગોયેલએ કરેલ. તેમ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની અખબારી યાદીમાં જણાવ્યું છે.